

M.Com Semester - 4 (CBCS) Examination
May/June-2021 (NEW COURSE)
Advanced Corporate Accounting(Core)

Time: 1:30 Hours

Marks: 42

Instructions:

1. Figures to the right indicate marks.
2. There are five questions in the question paper.
3. Answer any three of the following questions.

પ્રશ્ન-૧ કાલિંદી લિમિટેડનું નફા - નુકશાન ખાતું નીચે મુજબ છે. કંપનીધારા પ્રમાણે મેનેજીંગ ડિરેક્ટર અને (૧૪) ડિરેક્ટરોને ચુકવવાપાત્ર મહેનતાણાની ગણતરી કરો.

વિગત	રકમ	વિગત	રકમ
વહિવટી ખર્ચાઓ	8,00,000	કાચો નફો	24,00,000
લોન પર વ્યાજ	1,00,000	રોકાણ વેચાણ નફો (લાંબાગાળાના રોકાણો)	30,000
મેનેજીંગ ડિરેક્ટરને મહેનતાણુ	30,000	ડિવિડન્ડ	18,000
ઘસારો (માન્ય રૂ. 90,000)	1,10,000	ટ્રાન્સફર ફી	2,000
ડિરેક્ટર ફી	8,000		
મુડી પરત અનામત	80,000		
કરવેરા જોગવાઈ	5,00,000		
વિકાસ વળતર અનામત	30,000		
ચોખ્ખો નફો	7,92,000		
	24,50,000		24,50,000

પ્રશ્ન-૨ મોટુ અને પતલુ લિમિટેડનું તા. 31-12-2020 ના રોજ પુરા થતા વર્ષનું પાકુ સરવૈયું નીચે મુજબ છે. (૧૪)

જવાબદારી	મોટુ લિ.	પતલુ લિ.	મિલકતો	મોટુ લિ.	પતલુ લિ.
શેરમુડી (દરેક રૂ. 10નો તેવા)	2,40,000	60,000	જમીન-મકાન	1,40,000	50,000
સામાન્ય અનામત	50,000	12,000	પ્લાન્ટ - યંત્રો	64,000	20,000
નફા-નુકશાન ખાતું	24,000	18,000	રોકાણો (પતલુ લિ. ના 5,000 શેરમા રોકાણ સહિત)	60,000	5,000
લેણદારો	40,000	15,000	સ્ટોક	36,000	6,000
			દેવાદારો	44,000	14,000
			બેંક સિલક	10,000	10,000
	3,54,000	1,05,000		3,54,000	1,05,000

મોટુ લિમિટેડે તા. 30-6-2020 ના રોજ પતલુ લિમિટેડના 5,000 શેર રૂ. 50,000 ની કિંમતે ધારણ કર્યા. તા. 1-1-2020 ના રોજ પતલુ લિમિટેડના નફા-નુકશાન ખાતાની બાકી રૂ. 3,000 (જમા) હતી. ઉપરોક્ત માહિતી પરથી તા. 31-12-2020 ના રોજ પુરા થતા વર્ષનું એકત્રિત પાકુ સરવૈયું તૈયાર કરો.

તા. ૩૧-૩-૨૦૨૧ ના રોજનું પાકું સરવૈયું

જવાબદારી	રકમ	મિલકતો	રકમ
છકવિટી શેરમુડી (દરેક રૂ. ૧૦ નો તેવા)	૧,૮૦,૦૦૦	પાઘડી	૧૦,૦૦૦
અનામત અને વધારો	૨૦,૦૦૦	પ્લાન્ટ	૧,૨૦,૦૦૦
લેણદારો	૫૦,૦૦૦	ફર્નિચર	૫,૦૦૦
દેવીકુંડી	૨૦,૦૦૦	સ્ટોક	૮૦,૦૦૦
ચુકવવાના બાકી ખર્ચા	૫,૦૦૦	દેવાદારો	૪૦,૦૦૦
		અગાઉથી ચુકવેલ ખર્ચાઓ	૩,૦૦૦
		રોકડ અને બેંક	૧૭,૦૦૦
	૨,૭૫,૦૦૦		૨,૭૫,૦૦૦

અન્ય માહિતી:

- મિલકતોની આકારણી નીચે મુજબ કરવામા આવી.:
પ્લાન્ટ: રૂ. ૧,૧૦,૦૦૦, સ્ટોક: રૂ. ૮૭,૦૦૦, ફર્નિચર: રૂ. ૬,૦૦૦, દેવાદારો: રૂ. ૩૬,૦૦૦

- છેલ્લા ત્રણ વર્ષનો કરવેરા પછીનો નફો અને યોગ્ય ભાર નીચે મુજબ છે:

વર્ષ	નફો (રૂ.)	ભાર
૩૧-૩-૨૦૧૯	૩૦,૦૦૦	૧
૩૧-૩-૨૦૨૦	૩૩,૦૦૦	૨
૩૧-૩-૨૦૨૧	૩૧,૦૦૦	૩

- આ પ્રકારના ધંધામા અપેક્ષિત વળતરનો દર ૧૦% છે.

પાછલા ત્રણ વર્ષના ભારિત સરેરાશ નફાને ધ્યાને લઈ અધિકનફાની ત્રણ વર્ષની ખરીદી જેટલી પાઘડીની રકમની ગણતરી કરો.

પ્રશ્ન-૪ પર્યાવરણીય હિસાબો એટલે શું? પર્યાવરણીય ઓડીટ સમજાવો.

(૧૪)

પ્રશ્ન-૫ ટૂંકનોંધ લખો. (કોઈપણ બે)

(૧૪)

- વાર્ષિક હિસાબો માટેની કાયદાકીય જોગવાઈઓ.
- અંકુશિત પડતર.
- શેરની આંતરિક કિંમતની પદ્ધતિ.
- માનવ સંપત્તિના હિસાબોના ફાયદાઓ.

English Version

- Que-1 Profit & Loss Account of the Kalindi Limited is given below. Calculate the remuneration payable to the managing director and the directors as per the Companies act. (14)

Particulars	Rs	Particulars	Rs.
Administrative expenses	8,00,000	Gross profit	24,00,000
Interest on loan	1,00,000	Profit on sale of investments (Long Term Investments)	30,000
Remuneration of Managing Director	30,000	Dividend	18,000
Depreciation (Allowable Rs. 90,000)	1,10,000	Transfer fees	2,000
Directors Fee	8,000		
Capital Redemption Reserve	80,000		
Provision for taxation	5,00,000		
Development Rebate Reserve	30,000		
Net Profit	7,92,000		
	24,50,000		24,50,000

- Que-2 The following are the Balance Sheet of Motu Limited and Patlu Limited as on 31-12-2020: (14)

Liabilities	Motu Ltd. (Rs.)	Patlu Ltd. (Rs.)	Assets	Motu Ltd. (Rs.)	Patlu Ltd. (Rs.)
Share Capital (Shares of Rs. 10 each)	2,40,000	60,000	Land & Building	1,40,000	50,000
General Reserve	50,000	12,000	Plant & Machinery	64,000	20,000
Profit & Loss A/c	24,000	18,000	Investments (Including 5,000 shares of Patlu Ltd.)	60,000	5,000
Creditors	40,000	15,000	Stock	36,000	6,000
			Debtors	44,000	14,000
			Bank balance	10,000	10,000
	3,54,000	1,05,000		3,54,000	1,05,000

Motu Limited had acquired 5,000 shares of Patlu Limited at Rs. 50,000 on 30-6-2020. The profit & Loss account of Patlu Limited stood at Rs. 3,000 (Credit) on 1-1-2020. From the above information, prepare a consolidated Balance sheet as on 31-12-2020.

- Que-3 The balance-sheet of Abhilasha Limited was as follows: (14)

Balance sheet as on 31-3-2021

Liabilities	Rs.	Assets	Rs.
Equity Share Capital (Each of Rs. 10)	1,80,000	Goodwill	10,000
Reserve & Surplus	20,000	Plant	1,20,000
Creditors	50,000	Furniture	5,000
Bills Payable	20,000	Stock	80,000
Expenses Outstanding	5,000	Debtors	40,000
		Prepaid Expenses	3,000
		Cash & Bank	17,000
	2,75,000		2,75,000

Additional Information: -

1. The assets were valued as follows:
Plant: Rs. 1,10,000, Stock: Rs. 87,000, Furniture: Rs. 6,000, Debtors: Rs. 36,000.
2. The profits after tax for the last three years and appropriate weights to be used are as under:

Year	Profits (Rs.)	Weight
31-3-2019	30,000	1
31-3-2020	33,000	2
31-3-2021	31,000	3

3. The reasonable return on capital invested in such type of business is 10%.

Ascertain the amount of Goodwill on the basis of three Year's purchase of super profit on the basis of the weighted average of past three years.

Que-4 What is Environment accounting? Explain the Environmental Audit. (14)

Que-5 Write Short Notes. (Any Two) (14)

1. Legal Provisions for Final Accounts
2. Cost of Control
3. Intrinsic Value of Share
4. Advantages of Human Resource Account
